

Date: 7th September, 2021

To,

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street, Fort,

Mumbai-400001.

Company Scrip Code – 543281

To,

National Stock Exchange of India Limited

Exchange Plaza, Plot no. C/1, G Block, Bandra-Kurla Complex, Bandra (W),

Mumbai-400051.

Company Scrip Code – SUVIDHAA

Dear Sir/ Madam,

Sub: Newspaper Advertisements - Notice of 14th Annual General Meeting, Book Closure Dates and e-voting information.

Pursuant to Regulation 30 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of newspaper advertisements published in the Financial Express (English -National Daily All Editions) and Financial Express (Gujarati Edition) newspapers on 7th September, 2021 regarding the 14th Annual General Meeting (AGM), dispatch of the Annual Report, Book Closure Dates and e-voting instructions for the 14th AGM of the Company in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

We request you to kindly take the same on your record.

Thanking you,

Yours faithfully,

For, Suvidhaa Infoserve Limited

Prachi Vijay Jain Company Secretary

Encl.: As above

Suvidhaa Infoserve Limited (Formerly known as Suvidhaa Infoserve Pvt. Ltd.)

FINANCIAL EXPRESS

ABANS ABANS ENTERPRISES LIMITED

CIN: L74120MH1985PLCU35243

8A, 3rd Floor, 227, Nariman Bhavan, Backbay Reclamatio

- 400 021. Tel No.: 022 - 6835 4100, Fax: 022 - 6179 0

ance@abansenterprises.com | Website: www.abansenterp

NOTICE OF 35" ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCE (VCVOTHER AUDIO VISUAL MEANS (OAVM), REMOTE E-VOTING

ote E-voting and E-voting during AGM

- s to exercise their right to vote ed at AGM. Members holding

- hoers attending the AGM who have not cast their vote by remote e-voting pible to cast their vote through e-voting during the AGM. Mo have voted through remote e-voting shall be eligible to attend the AGM; he shall not be eligible to vote at the meeting.
- ntact Mr. Amit Vishal, Senior Manager, NSDL at the designated email ID ting@nsdl.co.in or amitv@nsdl.co.in. or at telephone no. +91 -99202 64780 o
- Contact Ms. Pallavi Mhatre, Manager, NSDL at the designated email II evoting@nsdl.co.in or pallavid@nsdl.co.in or +91-75066 82281 or

RELIGARE ENTERPRISES LIMITED

CIN: 174899011984PLC146935

Regd. Office: 18 floor, Pt. 4,5790, P. Block,
Connaught Pface, New Delhi -110001

Phose: 9-11-14002 1400 | Tax Not: -19-111-4002 1401

Website: www.religare.com | remail: investorservice@religare.com
NOTICE OF THE 37" ANNUAL CENTRAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

of Financial Statements for the financial year 2002-72, Intro-e-mail addresses are registered with the Company/Registry of Participants in accordance with the General Circular Nos. 1941; 2009, April 19, 2000, May \$2,000 and January 13, 200, 1941; 2009, April 1950; 2009, April 2009, April 2009, April 1941; 1967; 2017; 2018; 2019

given that the 37. Annual General Meeting betweinsfer called as "AGM"; of Belgia of the Company" will be held on Wedendady, September 29, 2021 at AQD PM, IGS10 interesting / Other Audio Visual Means ("VC" / "OAVM") to transact the businesses a Notice dated August 28, 2021.
six sent the Notice of the AGM and Annual Report, including the Standalone an active financial Satisferments for the Financial year 2020-21, through electronic mode to the

of will commence on Friday, September 24, 2021 (1.00 P.M. IST) and onber 28, 2021 (5:00 P.M. IST). The remote e-voting module shall be after. Once the vote on a resolution is cast by the member, the member

'MCA Circulars'

-

RELIGARE

HIPOLIN LIMITED

Regd. Off. A/1/1, Nilkan Nr.Iyava Bus Stand, Sanand Vira Virochannagar (P.O.) 382170. CIN: L24240GJ1994PLC021719

E-mail ld: hipolin@hipolin.com, csapexapanchal@gmail.com website: www.hipolin.com

NOTICE OF THE 28th ANNUAL GENERAL MEETING REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that the **Twenty Eighth Annual General Meeting** ("AGM") of the Members of Hippoin Limited will be held on Thursday, September 30, 2021 at 2:00 p.m. at the Registered Office of the Company situated at A1/1 Nilkathi Industrial Estate, Sanand-Viramgam Hightway, Nr. Iyava Bus Stand, Via Virochannagar (PC.), T.a.: Sanand, Dist.: Ahmedabad-Se2170 to Iransact the Business as set out in the Notice of the AGM.

Electronic copies of the Notice of the 28th AGM and Annual Report for the financial year 2021-2021 have been sent to all the Shareholders whose E-mail Ids are registered with Registrar and Share Transfer Agent/ Depository Participant(s) on September 04, 2021. The same are also available on the website of the Company at www.hipolin.com, Notice of AGM and Annual Report, have been sent to all Shareholders, other than whose E-mail Ids are not registered, at their registered addresses in the permitted mode. on September 04, 2021.

Members holding shares whether in physical form or dematerialised form, as on the cut-off date of of genember 23, 2021 may cast their viote electronically on the business set forth in the Notice of the AGM through electronic voting system on Central Depository Services (fidia) Limited (CDSL) from a place other than venue of the AGM ("Remote e-Voting"). All the members are informed that:

- The business set forth in the Notice of the AGM may be transacted through voting by electronic means.

Place : Ahmedabad Date : September 06, 2021

- The remote e-voting shall commence on September 27, 2021 (9:00 a.m.)
 The remote e-voting shall end on September 29, 2021 (5:00 p.m.)
 The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is
 September 23, 2021. E-voting by electronic mode shall not be allowed beyond 5:00 p.m. IST on September 29,
- 2021.

 Members voting may note that: a) The remote e-voting module shall be disabled by CDSL beyond 5:00p.m. on September 29, 2021 and once vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently. b) The facility for voting through ballot paper shall be made available at the AGM: c) The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and d) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility for remote e-voting or voting at the AGM through ballot papers.
- through ballot papers.
 The Company has appointed Ms. Megha Samdani, Practicing Company Secretary (Membership No. ACS 41630 and Certificate of Practice No. 21853) as the Scrutinizer to scrutinize the e-voling process in a fair and transparent manner.
 The Notice of 28* AGM is available on the Company's website: www.hipolin.com and also on the CDSL's website: www.cdslindia.com.

on the CDSL's website: www.odslindia.com.

X. In case of queries relating to e-voting, members/ beneficial owners may refer to the Frequently Asked Questions (FACs) for Shareholders and e-voting user manual available at the help section of www.evotingindia.com., or write an email to helpdesk.evoting@cdslindia.com.

Further notice is also given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with relevant rules made thereunder and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members of the Company and Share Transfer Books of the Company will remain closed from Friday. September 24, 2021 to Thursday, September 30, 2021 (both days inclusive) for the purpose of AGM.

For Hipolin Limited.

CAPITAL INDIA

CAPITAL INDIA FINANCE LIMITED
Identity Number (CIN): L74899DL1994P

CAPITAL INDIA & TRANSIC LIMITED

COmposel leightly Whenley CINI, 1149509,13947C128577

Repd. Office: 2nd Floor, DIF Centre, Sanada Murg. New Delhi - 11000.1 Pr. No. 011-49546000

Corpored office, A 120, 200 Med. 141 The 11000.1 Pr. No. 011-49546000

Corpored office, A 120, 200 Med. 141 The 11000.1 Pr. No. 011-49546000

Corpored office, A 120, 200 Med. 141 The 11000.1 Pr. No. 011-49546000

Webbite: www.capitalindia.com, Email ID, secretarial@capitalindia.com

NOTICE OF 27TH ANNIAL GENERAL MEETING TO BE HELD PERROUGH VIDEO CONFERENCING (VCT)/

OTHER AUDIO VISUAL MARIS CONVINT AND INFORMATION ON E-VOTING

NOTICE IS breatly given that the 2T (Premiss Seembl Amenia Caneral Meeting), CARMY of the Members of Capita

VICADAWIN to transact the businesses as set out in the Notice of ADA, a compliance with the applicable provision

of the Companies AC 120.3 (Tr. Mar 71) and the rules made thermode, and the Securities and Schange Board of noils (Little) Collegations and Surface and Capital Conference of the Meeting Adaptions and Exchange Board of India (SERF) (Circles Inc.) (Circles Inc.) (Circles Nov. 2002) dated by the Companies August (Circles Nov. 2002) dated by the Companies August (Circles Nov. 2002) dated by the Companies According to the Companies According to a March Carcinal Schange Board of India (SERF) (Circles Nov. 2002) dated by the Companies According to the Meeting Septial De deemed to be the Registered Office of the Company is. 2 And 160 office. DIF Centre (Circles Septial Control on Septial Circles Septial Circles

-



APIS INDIA LIMITED

NOTICE OF THE 39th ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

dated August 14, 2021.

outbreak of the CVUD-19 pandemic, social distancing norm to be followed and the continuing of persons at several places in the country and pursuant to General Circular Nos.14/2020. 17(2020). 1

to Section 91 of the Companies Act, 2013 and Rule made thereunder and Ru

For APIS India Limit

Managing Director DIN:00951321

suvidhaa

SUVIDHAA INFOSERVE LIMITED

SUVIDAA INTOSEKVE LIMIED

(CIN: L72900GJ2007PLC109642)

Registered Office: Unit No. 02, 28° floor GIFT - II Building, Block No. 56, Road 5C, Zone 5, GIFT City, Gandhingagar - 382355, Gujarat

Corporate Office: 14, Olympus Industrial Estate, Off. Mahakali Caves Road, Andheri (East), Mumbai-400093

Tel.: +91 9223225225 E-mail: cs@suvidhaa.com Website: www.suvidhaa.com

NOTICE 05 THE 14" ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE DATES AND E-VOTING INFORMATION

DILCE is better wiene that the 14" Annual General Meeting ("AGM") of the members

BOOK CLOSURE DATES AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 14* Annual General Meeting ("AGM") of the members of Suvidhaa Infoserve Limited ("the Company") will be held on Tuesday, 28° September, 2021 at 11.00 a.m. IST through video conferencing ("VC") or Other Audio Video Means ("OAVM") to transact the businesses as set out in the Notice of the AGM. The Company has dispatched the Annual Report for the Financial Year 2020-21 along with the Notice convening AGM through electronic mode on Monday, 6° September, 2021 only to the members whose e-mail addresses are registered with the Company and/or Depositories and/or RTA in compliance with General Circular No. 20/2020 dated 5* May, 2020 read with General Circular Nos: 14/2020, 11/2020 and 02/2021 dated 8° April, 2020, 13° April, 2020 and 13° January, 2021, respectively issued by the Ministry of Corporate Affairs (MCA Circulars) and Circular Nos. SEBI/HO/CFD/CMD2/CIR/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 12* May, 2020 and 15° January, 2021, respectively issued by the Securities and Exchange Board of India (SEBI Circulars).

The Annual Report for the Financial Year 2020-21 along with the Notice convening the AGM is

issued by the Securities and Exenange Board of India (SEB) Circulars).

The Annual Report for the Financial Year 2020-21 along with the Notice convening the AGM is also available on the website of the Company at www.suvidhaa.com, websites of the Stocl Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com the e-voting website of National Securities Depositor Limited (NSDL) at www.evoting.nsdl.com.

Limited (NSDL) at www.evoting.nsdl.com.

Notice is hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 ("Act") read with applicable rules made thereunder and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Wednesday, 22" September, 2021 to thesday, 28" September, 2021 to the day inclusive), for the purpose of 14" AGM of the Company. In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the SEBI Listing Regulations, the Company is providing to its Members the facility of remote e-voting before/during the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed NSDL for facilitating voting through electronic means. The detailed instructions for remote e-voting are given in the Notice of the 14" AGM. Members are requested to note the following:

a. The Remote E-Voting facility would be available during the following period-

- are requested to note the following:

 a. The Remote E-Voting facility would be available during the following period:

 Commencement of remote e-voting Friday, 24° September, 2021 (10:00 a.m. IST)

 Conclusion of remote e-voting Monday, 27° September, 2021 (5:00 p.m. IST)

 The remote e-voting module will be disabled by NSDL for voting thereafter and Members will not be allowed to vote electronically beyond the said date and time.

 b. The voting rights of the Members shall be in proportion to their share of the paid-up equity share capital of the Company as on Tuesday, 21° September, 2021 ("cut-off date"). E-voting facility will be available during AGM. Members, who have already cast their vote by remote e-voting prior to the AGM may remain present at the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again during AGM.
- Those persons who have acquired shares and have become members of the Company after e-mailing of the Notice of the AGM by the Company and whose names appear in the Register of Members of the Company/ in the statement of beneficial owners maintained by the depositories as on cut-off date can exercise their voting rights through e-voting by following the procedure as maintained in the said Notice of AGM.
- d. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholder and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.usdl.com or call on toll free no: 1800 1209 990 and 1800 22 44 30 or send request to Ms. Sarita Mote at evoting@nsdl.co.in

For Suvidhaa Infoserve Limit

Ahmedabad

Place: Ahmedabad Date: 6th September, 2021 Company Secretary and Compliance Office

financialexp.epapr.in

Place: New Delhi

ડીસીબી બેંક



મિલકતોનું ઓનલાઇન ઇ–હરાજી વેચાણ કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ

kotak

મિલકતોનું ઓનલાઇન ઈ-હરાજી વેચાણ કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ

(952) 20 તા રજ બાહરા, દા ૧૪,૭ આન, ગાલુ કુલા ૧ વર્ષો, ગાલુ પણ, શાળા ઓફીસ : જી૧, ટવીળ ટાવર, સહારા દરવાળ, ટીંગ રો સ્થાવર મિલકતીના વેચાણ માટે વેચાણ ગોટીસ ૧/૧-૧/૧૩/૦-૧ (૧૦૧૫) ૧૦૦૦ ના (૧૦૧૫ ૮(૫) અને ૮(૬) ની જોગ

2011 C (Mes char) વેચાઇ માટે 2 2010 માટે 2 (ક્લારોડી ઉપલ્સેક) (અંગુલેક્સ) [સ્વર્ક્સ મારે માટે 2 2010 માટે 2 (ક્લારોડી ઉપલ્સેક) (અંગુલેક્સ) [સ્વર્ક્સ મારે માટે અલ્લેક (સ્વર્ક્સ) (એક લે દ્વારં) મેં માટે અલ્લેક (સ્વર્ક્સ) (એક (સ્વર્ક્સ) માટે અલ્લેક (સ્વરક્ષ) (એક લે ક્લારક) (એક લે કલારક) (એક લે કલારક

હત્યાં લોક્યુંલે આ પ્રાન્થભાર ના પ્લાન્સ હતાની મિલાલીના સંબંધાની કોમમાં સ્પારતા / પેફરેશાતભા અભ્યાન બીડિસી તો સામે પ્લાન્સ હતાની મિલાલીના સંબંધાની કોમમાં સ્પારતા / પેફરેશાતભા અભ્યાન બીડિસી તો સંબંધ હતા. (૧૧ દ્વારા સ્વર્પ્યુપ્ત માત્ર કોમ હતા. (૧૧ દ્વારા સ્વર્પ્યુપ્ત માત્ર કોમ હતા. (૧૧ દ્વારા ૧૧ દ્વારા પ્લાન્સ (૧૧ દ્વારા ૧૧ દ્વારા માત્ર કોમ હતા. (૧૧ દ્વારા ૧૧ દ્વારા માત્ર કોમ હતા. (૧૧ દ્વારા ૧૧ દ્વારા પ્લાન કાર્યો હતા. (૧૧ દ્વારા ૧૧ દ્વરા ૧૧ દ્વારા ૧૧ દ્વરા ૧૧ દ્વારા ૧૧ દ્વારા



સાંકેતિક કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

સાવાદ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોમાપા સોદી કીરીઓ એક લીમીટેકની ટકાય કું (પ્રિસ્તા માતા વાળ તેમાનું જગ્ન હતો પ્રસ્તા અને કિર્મેટ રોમા પૂત્ર) રહ્યા પ્રસ્તા અને કિર્મેટ રોમા પૂત્ર) રહ્યા પ્રસ્તા અને કિર્મેટ રોમા પૂત્ર) રહ્યા પ્રસ્તા અને કિર્મેટ રોમા પ્રસ્તા અને કિર્મેટ રામા પ્રસ્તા કરત દરવાલ્યાના સાથેને આક્રિત રહેશે કહ્યા કૃત્ય કર્યાલ મિલકતની વિઝત વ્યવસ્થાન મિલકતની વિઝત વ્યવસ્થાન સ્થાન મિલકતની વિઝત વર્ષોટ સ્થાન મિલકતની વિઝત વર્ષોટ સ્થાન મિલકતની વિજત કર્યાલ મિલકતની વિજત કર્યાલ મિલકત કર્યાલ મિલકતની સ્થાન કર્યાલ મિલકતની સ્થાન કર્યાલ મિલકત કર્યાલ ક્લાન કર્યાલ કર્યાલ કર્યાલ ક્લાન કર્યાલ કર્યાલ કર્યાલ ક્લાન કર્યાલ કરવાલ કર્યાલ કર્યાલ કરવાલ કર્યાલ કરાયાલ કર્યાલ કરાયાલ કર્યાલ કર્યાલ

શ્રી ભવ્ય ફેબ્રિક્સ લિમિટેડ

સીઆઇએન: L17119GJ1988PLC011120 જુસ્ટર્ડ ઑફિસ: સર્વે નંબર ૧૭૦, પીરાણા રોડ, પીપલેજ, અમદાવાદ, ગુજરાત, ૩૮૨૪૦૫

વાર્ષિક સામાન્ય સભા: શ્રી ભવ્ય કેબ્રિક્સ વિમિટેડના સલ્યોને આથી નોટિસ આપવામાં આવી છે કે કંપનીની 3.3મી વાર્ષિક સામાન્ય સભા (બેજીએમ) મંગળવારે, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૧ ના રોજ બપોરે 02:30 કલાકે વિડીચી કોન્ફરનિર્સન ("VC) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ ("ONM") માર કરો ચોલાશે. જેમા વાર્ષિક સામાન્ય સભા ની નોટિસમાં ઉલ્લેખિત કામ કાજ ક્ષારા પરવામાં બવશે.

કાજ કહ્યું ધરવામાં અવશે. એજીએમ માટે વૃક્કલીઝર: સહ્યોની નોધણી અને કંપનીની શેર ટ્રાન્સકર બુક ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ (બંનેદિવસી સફિત) વાર્ષિક સામાન્ય સભા માટે બંધ રહેશે.

સપ્ટેમ્બર, ૨૦૨૧ (અને દિ વર્ષો સહિત) વાર્ષિક સામાન્ય સભા માટે બંધ રહેશે. ઇરિક્રેટ્રીક મામપ્રસાર મરદાવ્ય: કંપની પારી, ૨૦૧૩ ની કલાય ૧૦૮ અનુસાર કંપનીઓ (મેનેજર્મન્ટ અને એડિનિસ્ટ્રેમના થયો. ૨૦૧૪ નો લિયા ૨૦ અમે તેવી (1008 ના નિયા પર ૪ સાઢે વાંચવામાં આવે છે કે કંપની તેના સલ્યોને ઇરિક્રેડ્રીનીક માધ્યમાંથી તેમના મતના પારીકારનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાર્ટે ૭ (૧૪૫૩ છે. વોટિંગ) જે સન્દ્રત્ય ઉપ્પોગ્ડિકરી સર્વિધીસ હિમિટેડ રાસીડિએસએલ્યુ કાર પૂરી પાડવામાં આવેલ છે, ૩૩મી એડ્ર્જીએમની નીસિંગ્ડમાં નિર્ધારિત પાર્ટમાં અને સમયર શનિવાર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સવારે-૯૦૦ લાખાવાં શરૂ કર્યો કરવાની તારીખ અને સમયર સનિવાર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સવારે-૯૦૦ લાખાવાં શરૂ કર્યો કર્યા કરવાની સાર્ટીખ અને સમયર સનિવાર, ૨૫મી સપ્ટેમ્બર,

ર0૨૧ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી રહેશે 3) મત આપવાની પાત્રતા નક્કી કરવા માટે કટ ઓફ તારીખ: મંગળવાર, ૨૧મી

સારે માળ, 2029 રહેશે. 39 સંસ્થાઓ અને 16 કેવા માં અને આદિ થી લાગુચાલ મીનસ લિવો માં અલ્લે એ જે લિવોલી એક કેવાનિયા માં ભજ રહેશે અને વિમોદ અને નિર્દેશ લાવો કરાયાના સલા માં ભજ રહેશે અને વિમોદ અને નિર્દેશ લાવ કરાયો નિર્દેશ લાવ કરાયો માં આવ્યા ન ના તો તે દરિપોલા અને મોદિનિ સિફ્ટમ લાવા માં આપવા માટે લાવો કો કાયો એ જે લાવોએ લાર્પિક મામ્યાન્ય સલા પહેલા દે મોટ કરે નોડિંગ લાવ મન આપવા છે તેઓ લિવો એ કોન્કરનિર્દેશ (પ્રેપ્ત) અન્ય આદિ શે લાગ્યાના છે તેઓ લિવો એ કોન્કરનિર્દેશ (પ્રેપ્ત) અન્ય આદિ શે લાગ્યાના સાથે કોન્કરનિર્દેશ (પ્રેપ્ત) અન્ય આદિ શે લાગ્યાના સાથે કોન્કરનિર્દેશ (પ્રેપ્ત) અન્ય લાગ્યાના માટે કહાર રહેશે નહીં. યૂ. 33 મી લાવી કેલ સામાન્ય સલા ની નોટિસ કંપનીની વેબસાઇટ www.sheethinyalabrics.com અને CDSLની વેબસાઇટ www.sheethinyalabrics.com અને C

www.shreebinayatlauniz.com ખર પ્રત્યા પર ઉપલબ્ધ વારે વાર પૂછતા પશ્ચે કરતા કરતા કરતા પર ઉપલબ્ધ વારે વાર પૂછતા પશ્ચે (FAIS) અને ઇ-લોટિંગ સેન્યુલબનો સંદર્ભ લઈ શકે છે અથવા helpdesk.evoling.com, પર ઇમેઇલ લખી શકે છે. helpdesk.evoling.com વારે ક્રિકેસ સ્વર્થ ક્રિકેસ્ટર વર્તી

💶 🖚 ચુનાઈટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ

સીઆઇએન : L18109GJ2010PLC062928 સ્ટર્ડ ઓફિસ : સર્વે નં. ૨૩૮, ૨૩૯, શાહવાડી, ન્યૂ આરવી કેનીમની સામે, નારોલ-સરબેજ હાર્ધવે, અમદાયાદ, ગુજરાત-૩૮૨૪૦૫. ભારત 10.070767315E Whethermore of Examiliate Quantidate hab

કંપની અને ઇ-વોટિંગની 11 મી વાર્ષિક સામાન્ય બેઠકની સૂચના

શ્રાાલાત.com. શ્રી ભવ્ય ફેબ્રિક્સ લિમિટેડ વતી જગદીશ એસ કણઝારીયા કંપની સેક્રેટરી

NANDAN DENIM LIMITED

CIN: L51909GJ1994PLC022719

Nandan Registered Office: Survey No. 198/1 & 2032,

and will define the office of the company of the co Tel.: 079-267346660/2/3 Website: www.nandandenim.com Email: cs.ndl@chiripalgroup.com

NOTICE

Dear Member(s),

- ear Member(s).

 Notice is hereby given that the Twenty Seventh Annual General Meeting of the Company ("27" AGM") will be convened on September 30, 2021 at 03:00 p.m. through Video Conference ("VC")(Other Audio Visual Means ("OAVM") Ideality in compliance with the applicable provisions of Companies Act 2013 and Rules framed thereunder and the SEBI (Listing Obligations And Disclosures Requirement) Regulations 2015 read with the Ministry of Corporate Affairs ("MCA") circular dated April 13, 2020 and April 13, 2020 and January 13, 2021 (collectively referred to as "MCA Circulars") and Securities and Exchange Board of India Circular No. SEBI/HO/CFD/CMD1/CTR/P/2020/179 dated May 12, 2020 and SEBI/HO/CFD/CMD1/CTR/P/2021/11 dated January 15, 2021 (referred to as SEBI Circular) without the physical presence of the members at a common venue.
- without the physical presence of the members at a common venue.

 The Annual Report for the year 2002-21 including the financial statements for the year ended March 31, 2021 ("Annual Report") will be sent only by email to all those Members, whose email addresses are registered with the Company or with their respective Depository Participant ("Depository"), in accordance with the MCA Circulars and the SEBI Circular. Members can join and participate in the 27th AGM through VC/OAVM facility only. The instructions for joining the 27° AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the 27° AGM are provided in the Notice of the 27° AGM ambers participating through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under section 103 of the Companies Act 2013. The Notice if the 27° AGM and the Annual Report will also be available on the website of the Company i.e. www.nandandenim.in and the website of stock exchanges.
- Company i.e. www.nandandenmm.n and the website of stock exchanges.

 Members holding shares in physical form who have not registered their email addresses with the Company/ Depository can obtain Notice of the 27* AGM, Annual Report and/or login details for joining the 27* AGM through VC/OAVM facility including e-voting, by sending scanned copy of the following documents by email to scandific/hirphalgroup.com.

 a. a signed request letter mentioning your name, folio number and complete address
- b. self attested scanned copy of the PAN Card, and
- c. self attested scanned copy of any document (such as AADHAR Card, Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member as registered with the Company.

 Members holding shares in demat form are requested to update their email address with their
- Book Closure dates are from Friday, September 24, 2021 till Wednesday, September 29, 2021 (both dates inclusive).

(notin dates incusive).

a above information is being issued for the information and the benefit of all the Members of Company and is in the compliance with the MCA Circular and the SEBI Circular.

For NANDAN DENIM LIMITED

Place: Ahmedabad Date: September 6, 2021

Purvee Roy Company Secretary

suvidhaa

સુવિદ્યા ઇન્ફોસર્વ લીમીટેડ

[CIN: L7290GJ2007PLC109842] **૨જીસ્ટર્ડ ઓફીસ** : ચુનિટ નં. ૦૨, ૨૮મો માળ, ગીફ્ટ- ર બિલ્ડીંગ, બ્લોક નં. ૫૬, સંડ પસી, ઝોન પ, ગીફ્ટ સિટી, ગાંધીનગષ્ટ- ૩૮૧૩૫૫, ગુજરાત **કોર્પોરેટ ઓફીસ** : ૧૪, ઓબપમ છન્કરીયલ એક્ટરે, મહાકાળી ઠેલ્ય શેડ પડખે, બાંધીરી (કસ્ટ), મુંબઇ-૪૦૦૯૩ ફોન : +૯૧ ૯૨૩૨૨૫૨૨૫ ઇમેઇલ : <u>૮૬@suvidhaa.com</u> વેબસાઇટ : <u>www.suvidhaa.com</u>

કંપનીની ૧૪મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ, બુક બંધ તારીખો અને ઇ-વોટીંગ માહિતી

. તાથી નોટીસ આપવામાં આવે છે કે સુવિધા ઇન્ફોસર્વ લીમીટેડના સભ્યોની ૧૪મી વાર્ષિક સામાન્ય સભા (''એજીએમ") મંગળવાર આપી નોદીસ આપવામાં આવે છે કે સુવિધા છત્કારતે લીમીટેઠના સભ્યાની ૧૪મી વાર્ષિક સામાન્ય સભા (''એજીએમ') મેગલાવાડ, ૨૮ સહેમ્બર, ૨૦૨૧ ના કોજ સવારે ૧૧,૦૦ કહ્યાં કે લિપ્રિકો નેક્સ્મિત (લીધી) / અન્ ઓરિપ્રો વિસ્મૃત્રન્ત મામ્યત્રો નિર્ણાસનુ મામ્યત્રો નિર્ણાસનુ મામ્યત્રો કર્યો હતા. (ઓએસોએમ) દ્વારા એજીએ મામ્યત્રો કર્યો હતા. ૧૮૦ કર્યા હતા. વેચાના જનરલ પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, ૧૭ ક્લેપ્રિકા, ૧૦૦ કર્યો હતા. ૧૦૦ કર્યા હતા. ૧૦૦ કર તને/અથવા ડિપોઝીટરીઓ અને/અથવા આરટીએમાં ૨જીસ્ટર્ડ છે તેમને ફક્ત ઇલેક્ટ્રોનિક પદ્ધતિ મારફત સોમવાર, ૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ રવાના કરેલ છે.

તાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧નો વાર્ષિક અહેવાલ તેમજ એજીએમ બોલાવતી નોટીસ કંપનીની વેબસાઇટ <u>www.suvidhaa.con</u> મને સ્ટોક એક્સચેન્જો એટલે કે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટ અનુક્રમે <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> અને નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ) ની બસાઇટ <u>www.evoling.nsdl.com</u> પર ઉપલબ્ધ કરાવામાં આવશે.

કંપની કાયદા, ૨૦૧૩ (એક્ટ) ની કલમ ૯૧ સાથે વંચાતા તે હેઠળ બનેલ લાગુ નિયમો અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને રિક્ષકલોજ ર ઊઠવાયરમેન્ટ્સ) ટેચ્યુલેશન, ૨૦૧૫ ના કેચ્યુલેશન ૪૨ યુજબ આથી નોટીસ આપવામાં આવે છે કે કેપનીના રજીસ્ટર ઓક મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ બુધવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ થી મંગળવાર ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ (બંને દિવસો સહીત) સુધી કંપનીની ૧૪મી એજીએમના હેતુસર બંધ રહેશે.

ર્કપની કાયકા, ૨૦૧૩ની કલમ ૧૦૮ સાથે વંચાતા કંપની (શ્વવસ્થાપન અને પ્રશાસન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦, સુધાર મુજબ, સેબી લિસ્ટીંગ રેગ્યુલેસન્સના નિયમન ૪૪ અંતર્ગત કંપની એજીએમમાં પાર પાડવાના કાર્યોના સંદર્ભમાં એજીએ પહેલા/દરમિયાન રીમોટ ૭-વોટીંગની સવલત તેના સભ્યોને પુરી પાશે રહી છે અને આ કાર્ય માટે કંપનીએ ઇલેક્ટ્રોનિક માથમં મારક્ષન મતદાનની સવલત આપવા માટે એનએસડીએલની નિયુક્તિ કરી છે.

શિમોટ ઇ-વોટીંગની વિગતવાર સુચનાઓ ૧૪મી એજીએમની નોટીસમાં આપેલ છે. સભ્યોને નીચેનાની નોંધ લેવા વિનંતી છે એ. રીમોટ ઇ-વોટીંગની સવલત નીચે સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે.

રીમોટ ઇ-વોર્ટીંગની શરૂઆત શુક્રવાર ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ (સવારે ૧૦.૦૦ કલાકે) રીમોટ ઇ-વોર્ટીંગની સમાપ્તિ સોમવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ (સાંજે ૫.૦૦ કલાકે)

- ુચિમાંટ છ-નાર્ટીંગની સમાપ્તિ ામાચાર, ૨ ૭ સપ્ટેમ્બર, ૨૦૧૧ (સીજે ૫,૦૦ કલાક)
 ચીમોંટ ઇ-નાર્ટીંગનો પ્રુપ્તુ ત્યારબાદ મતદાન માટે એનએસ ટીએલ દ્વારા બંધ કરવામાં આવશે અને સભ્યો જણાવેલ તારીખ અને
 સમય પછી ઇલેક્ટ્રોનિકલી મત આપવાની પરવાનગી મળશે નહી.
 સભ્યોના મતદાનના હકો મંગળવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ (ક્ટ-ઓફ તારીખ) ના રોજ કંપનીની ભરપાઇ થયેલ શેર મુ દ્વીન તેમના હિસ્સાને અનુષ્ટ્રય રહેશે, ઇ-નોર્ટીંગ સવલત એક્કએમ દરિયામાં ઉપલબ્ધ રહેશે, જે સભ્યોએ એક્કએમ પહેલા રીમોટ ઇ-નોર્ટીંગલી નિયાન મત આપણે તેઓ વીસીઓએવીએમ મારફત એક્કએમાં હાજર રહી શકશે, પરંતુ એક્કએમ દરિયાન કરીશી તેમના મત આપવા માટે હકદર ગણાશે નહી. કંપનીએ એક્કએમની નોટીટેસના ઇમેઇલ કર્યા પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અથવા કંપનીની સભ્ય બનાન કર્યા
- કટ-ઓફ તારીખના રોજ કંપનીના રજીસ્ટર ઓક મેમ્બર્સમાં/ ડિપોઝીટીરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોના નિવેદનમ ૩૦ - માડા મારાવિયા ૧૩ - ૧૧ પાયા ૧૭૦૦ - માક ને વ્યવસાય (અધાદારાયા પ્રાપ્ત વસાવાલ લાગાવા માલકાના ભવક હાજ ૨૭ તેવી કોઇપણ વ્યક્તિઓ આ એજએમની નોટીસમાં જણાવેલ પ્રક્રિયા અનુસરીને ઇ-વોર્ટીંગ મારફત તેમના મતદા હકોનો ઉપયોગ કરી શકે છે.
- કોઇપણ પુછપરછના કિસ્સામાં www.evoting.nsdl.com ના ડાઉનલોડસેક્શનમાં ઉપલબ્ધ શેરહોલ્ડરોના વાંરવાર પુછા પ્રશ્નો (એકએક્યુએસ) અને શેરહોલ્ડરો માટેનું ઇ-વોટીંગ યુઝર મેન્યુલ જોઇ શકે છે અથવા ટોલ ક્રી નં.૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૮૦ ૨૨ ૪૪ ૩૦ ને કોલ કરી શકો છો અથવા શ્રીમતી સરીતા મોટેને evoting@nsdl.co.in ઉપર અરજી મોકલી

સુવિદ્યા ઇન્ફોસર્વ લીમીટેક વતી, સહી/-

CIL NOVA PETROCHEMICALS LIMITED SCHIRIPAL

Survey No. 396 (P), 395/4 (P), Moraiya Village, Sarkhej - Bavla High
Tal.: Sanand, Ahmedabad -382210
ClN: L17111(312003PL043354
Contact No. +19182580000, 9825104042 Fax: +91 250556, 251612
Email: investorgrievances.cilnova@chiripalgroup.com, Website: www.cnpcl.co

Information Regarding (A) 17th Annual General Meeting and (B) Book Closure

- The 17th Annual General Meeting "AGM") of the Company will be held through video confer-encing ("VC") Other Audio-Visual Means ("OAVM") on Tuesday, 28th day of September, 2021 at 2:00 p.m. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 14/2020 dated 68* April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 and General Circular No. 20/2020 dated 5th May, 2020 and other applicable circular issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and SEBI (collectively referred as 'relevant circulars') to transact the business set out in the Notice calling the AGM. Members participating through the VC/OAVM facility will be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.
- 2013.

 In compliance with the relevant circulars, the Notice of the AGM and the Annual Report for the Financial Year 2020-21 will be sent to all the members in electronic mode whose e-mail addresses are registered with the Company/Depository Participant(s). The aforesaid document will also be available on the Company's website at www.encpel.com and on the website of the Stock Exchange ie BSE Limited at www.encpel.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com

- Manner of registering/updating e-mail addresses:

 a) Members holding shares in physical mode, who have not registered/updated their email addresses with the Company are requested to update/register the same by emailing to Company's Registrar & Share Transfer Agent i.e Link Intime India Pvt. Lid. at almedabad@inkintime.co.in or at company's mail address i.e harsh hirpara@chiripalgroup.com b) Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses with the Depository Participants are requested to register/update their e-mail addresses with the Depository Participants with whom they maintain their demat accounts.
- Manner of casting vote(s) through e-voting:

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on all resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting/e-voting is provided in the Notice of AGM.

Book Closure Date & Cut-off Date:

- The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, 22st September, 2021 to Tuesday, 28st September, 2021 (both days inclusive) for the purpose of AGM, recommended by the Board of Directors for the financial year ended on 31st March, 2021.
- The cut off date for determining the eligibility to vote by remote e-voting/e-voting at the AGM is Tuesday, 21st September, 2021.
- Members are requested to carefully read the Notes set out in the Notice of the AGM and in particular instructions for joining the AGM, manner of casting vote through remote e-voting and e-voting during the AGM.

For, CIL Nova Petrochemicals Limited

Date: 6th September, 2021

Sd/-Harsh R. Hirpara Company Secretary

હીપોલીન લિમિટેડ

રજી. ઓફિસ : એ-૧/૧, નીલર્કઠ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સાશંદ-વિરમગામ હાઈવે, ઈયાવા બસ સ્ટેન્ડ પાસે, સાશંદ, વિરોચનનગર-૩૮૨૧૭૦. CN: L242406.11994PLC021719 E-mail Id: hipolin@hipolin.com, csapexapanchal@gmail.com website: www.hipolin.com

ર૮મી વાર્ષિક સાધારણ સભા, ઈ-વોટિંગ અને બુક બંધ તારીખ અંગેની માહિતી

આથી નોટીસ આપવામાં આવે છે કે હીપોલીન લિમિટેકની ૨૮મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) ગુરૂવાર તા. સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૧ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે અમારી કંપનીની રજિસ્ટર્ડ ઓફીસ : એન્૧/ન, નીલકેલ્ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેર, સાધાંદ-વિસ્માગમાં હાઈવે, ઇત્યાવ બસ સ્ટેન્ડ મારે, વાયા વિરોચનનગર, તા. સાધાંદ, જીલ્લી : અમદાવાદ-૩૮૨૧૭૦ ખાતે સભાની નોટિસમાં જ્ણાવ્યા અનુસાર સાધારણ અને ખાસ બિઝનેસ, જો કોઈ હ્રીય તે, ગાબતે મળશે.

બાબત મળશ. જે શેટવારકોના ઈ-મેઈલ આઈડી રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સકર એજન્ટ / ડિપોઝિટરી સહભાગી(ઓ)માં રજિસ્ટર્ડ છે, એ તમામ શેરચારકોને રત્યી એજીએમની નોટિસની ઈલેક્ટ્રોનિક નકલો અને નાશાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટેના વાર્ષિક એહેવાલ. ૦૪, સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજમોકલવામાં આવ્યા છે. આ નોટિસ અને અહેવાલ કંપનીની વેબસાઈટ www.hipolin.com પર પણ ઉપલબ્ધ છે. અન્ય તમામ શેરચારકોને એજીએમની નોટિસ અને વાર્ષિક અહેવાલ મંજૂર પલિતિમાં નોંધાયેલા સરાનામા પર ૦૪, સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજમોકલવામાં આવ્યા છે. કટ-ઓફ તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજફિઝિકલ કેડિમટિરિયલાઈઝ સ્વરૂપે શેર ધરાવતા સભ્યો એજીએમના સ્થળ સિવાયના અન્ય સ્થળેથી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડીયા) લિમિટર (સીડીએસએલ) પર ઈલેક્ટ્રોનિક હાર્યિઝ ચિઝ્ડમ પ્રક્રત્ને એજએમની નોગ્રિગમાં (લર્ધીયલ બ્રાબ્લ) પર ઈલેક્ટ્રોનિક લિ

વોર્ટિંગ સિસ્ટમ મારફતે એજીએમની નોટિસમાં ઉલ્લેખિત બાબતો પર ઈલેક્ટ્રોનિક્લી મતદાન કરી શકે છે. ('રિમોટ ઈ-વોટિંગ')

તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે :

- એજીએમની નોટિસમાં નકકી થયેલી કામગીરી માટે ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાન કરી શકાય
- રીમોટ ઈ-વોટિંગ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ (સવારના ૯.૦૦ ક્લાક) થી શરૂ થશે.
- રીમોટ ઈ-વોટિંગ રલ્ સપ્ટેમ્બર, ૨૦૨૧ (સાંજના ૫.૦૦ કલાક) થી પૂર્ણ થશે. ઈલેક્ટ્રોનિક માધ્યમો હ્વારા કે એજીએમમાં મતદાન કરવાની પાવતી નક્કી કરવા માટે કટ ઓફ તારીખ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ છે.
- પ્રેલેક્ટ્રોનિક માધ્યમો હારા ઈ-વોટિંગ તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે ક્લાક પછી માન્ય નહી ગણાય.
- મત આપવા ઉચ્છતા સભ્યો નોંધ કે (ક) રીમોટ ઈ-લોટિંગ મોડયુલ ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા પછી સીડીએસએલ દ્વારા બંધ કરવામાં આવશે અને સભ્ય એક વખત મતદાન કરશે પછી તેને બદલી શકાશે નહીં (ખ) એજીએમમાં બેલટે પેપર મારશ્તે મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. (ગ) એજીએમ અગાઉ રીમોટ ઈ-વોટિંગ મારશ્તે મતદાન કરનાર સભ્યો એજીએમમાં હાજર રહી શકે છે, પણ તેમને એજીએમમાં મતદાન કરવાનો અધિકાર નથી, અને (ધ) સભ્યોના રજિસ્ટરમાં નોંધાયેલી કે કટ ઓફ ડેટના રોજ ડિપોઝિટરીઝ ક્ષારા જાળવવામાં આવતા લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં સભ્યો તરીકે નોંધાયેલી વ્યક્તિને જ ... રિમોટ ઈ-વોટિંગની સુવિધાનો લાભ લેવાનો કે એજીએમમાં બેલેટ પેપર મારફતે મતદાન કરવાનો અધિકાર
- કંપનીએ ઈ-વોટિંગની પ્રક્રિયાને તટસ્થ અને પારદર્શક રીતે ચકાસવા સ્કૂટિનાઈઝર તરીકે મિસ. મેધા સામદાની, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી (સભ્યપદ નંબર ૪૧૬૩૦ અને સીઓપી નંબર ૨૧૮૫૩) ની નિમણૂંક કરી છે. ૨૮મી વાર્ષિક સભાની નોટિસની વેબસાઈટ www.hipolin.com પર સીડીએસએલની વેબસાઈટ
- www.cdslindia.com પર પણ ઉપલબ્ધ છે.

વોટિંગના સંબંધમાં કોઈપણ પ્રશ્ન હ્યેય તો સભ્યો / લાભાર્થી માસિકો શેરધારકો માટે અવારનવાર પૂછાતાં પ્રશ્નો (FAQ) જોઈ શકે છે અને www.evolingindia.comના હેલ્પ વિભાગમાં ઉપલબ્ધ ઈ-વોટિંગ મેન્યુઅલ જોઈ શકે છે. ઈ-વોટિંગના સંબંધમાં કોઈપણ ફરિયાદ હોય તો કૃપા કરીને ઈ-મેઈલ : helpdesk.evoting@cdslindia.com પર

સ્વતા આપવામાં આવે છે કે, કંપની ધારા ૨૦૧૩ની કલમ ૯૧ અનુસારા અને ૪૨ રેગ્યુલશન સેબી (*ફ્રઇ) રેગ્યુલેશન, ૨૦૧૫ના અનુસાર રજીસ્ટાર ઓક મેખ્બર્સ અને ટ્રાન્સકર બુક, શુક્રવાર, સપ્ટેમ્બર ૨૪, ૨૦૨૧ શી ગુરુવાર સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૧ સુધી (બંને દિલસ) સહિત) માર્ચ ૩૧, ૨૦૨૧ના રોજ પુરા થતા નાશાંક્રીય વર્ષ માટે કંપનીની ૨૮મી વાર્ષિક સાધારણ સભાના હેતુથી બંધ રાખવામાં આવશે. श्रीगोलीन विभिट्टेट वसी

પાગી જે

સ્થળ : અમદાવાદ તારીખ: ૦૬, સપ્ટેમ્બર ૨૦૨૧

અસિવારમી (11 મી) વાર્ષિક શામાનમ સભા (તેજીએમ) 28 માર્ટમાંગર, પુપત્વારો ચોજારી. 2020 માર્ચે અવલ્લા મોર્ચ સ્વાર્થ કર્યા ક કોલ કરી શકે છે. સહવે માત્ર પાર્ટીએ સાથે કરો હતી કરો હતા હતી કરો હતી કરે હતી કરો હતી કરે હતી કરે હતી કરે હતી કરે હતી કરે હતી કરો હતી કરે હતી ક

યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ વતી, ગગન મિત્તલ ચેરમેન અને મેનેજિંગ ડાયક્ટર ડીનઃ msq3377

સ્થળ: અમદાવાદ તારીખ: ૭ સપ્ટેમ્બર, 2021

થળ : અમદાવાદ તારીખ : દ્ સપ્ટેમ્બર, ૨૦૨૧

કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ ઓફીસર

મિલકતોનું ઓનલાઇન ઈ–હરાજી વેચાણ કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ